

# રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર

“આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT)-૨૦૧૭ પરીણામ જાહેરનામું  
(Head Masters Aptitude Test (HMAT)-2017) Result Notification

જાહેરનામાં ક્રમાંક:રાપબો/HMAT/૨૦૧૭/૭૨૯૦-૭૩૯૫

તા:૧૩/૧૦/૨૦૧૭

શિક્ષણ વિભાગના તા:૨૫/૦૭/૨૦૧૭ ના જાહેરનામાં ક્રમાંક:GH/SH/77/BMS/1115/1295/G થી રજિસ્ટર થયેલી ખાનગી(ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય પસંદગી માટેના "Principal in the Registered Private Secondary and higher Secondary Schools (Procedure For Selection) Rules-2017" બનાવવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક: બમશ/૧૧૧૭/૨૪૨૫/ગ, તા:૦૯/૦૮/૨૦૧૭ થી રજિસ્ટર થયેલી ખાનગી(ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકે નિમણૂક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક “આચાર્ય અભિરૂચિ કસોટી” યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ તા:૧૨/૦૯/૨૦૧૭ના જાહેરનામાં ક્રમાંક: રાપબો/HMAT/૨૦૧૭/૫૯૬૮-૬૦૧૩ થી રજિસ્ટર થયેલી ખાનગી(ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા:૦૮/૧૦/૨૦૧૭ (રવિવાર) ના રોજ બપોરે ૧.૦૦ કલાક થી સાંજે ૪.૦૦ કલાક દરમિયાન અમદાવાદ જિલ્લામાં આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT)-૨૦૧૭ (Head Masters Aptitude Test (HMAT)-2017)નું આયોજન કરવામાં આવેલ છે.

આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા:૦૯/૧૦/૨૦૧૭ ના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી અને આ પરીક્ષાના પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન/પ્રોવિઝનલ આન્સર કીનાં ઉત્તર સામે ઉમેદવાર રજૂઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમાં તા:૦૯/૧૦/૨૦૧૭ ( બપોરના ૧૨.૦૦.૦૦ કલાક) થી તા:૧૦/૧૦/૨૦૧૭ (રાત્રે ૨૩.૫૯.૫૯ કલાક) સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારોને સાથે વેબસાઇટ પર આપેલ લીંક પર ઓનલાઇન અપલોડ કરી મોકલી આપવા સૂચના આપવામાં આવેલ હતી.

ઉમેદવારો દ્વારા પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન/પ્રોવિઝનલ આન્સર કીનાં ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મુકવામાં આવેલ હતી. તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજૂઆતો અને આધારોની ચકાસણી કરી પ્રોવિઝનલ આન્સર કીમાં આપેલ ઉત્તરો પૈકી ૦૯ (નવ) ઉત્તરોમાં સુધારા કરવા ભલામણ કરેલ હતી. જે અન્વયે આ કચેરી દ્વારા તજજ્ઞ સમિતિની ભલામણના આધારે ૦૯ (નવ) ઉત્તરોમાં સુધારા કરી આજ તા:૧૩/૧૦/૨૦૧૭ ના રોજ ફાઇનલ આન્સર કી તૈયાર કરવામાં આવેલ છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૦૮/૧૦/૨૦૧૭ (રવિવાર) ના રોજ યોજાયેલ આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT)-૨૦૧૭ (Head Masters Aptitude Test (HMAT)-2017)માં હાજર ઉમેદવારોનું પરીણામ અને OMR Sheet તથા ફાઇનલ આન્સર કી આજ તા:૧૩/૧૦/૨૦૧૭ ના રોજ નીચેની વિગતે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે છે.

❖ પરીણામની વિગતો:

Category	Register	Absent	Present	Fail	Pass	Result (%)
General	7028	956	6072	1875	4197	69.12
SC	741	117	624	225	399	63.94
SEBC	1626	280	1346	436	910	67.61
ST	1077	213	864	442	422	48.84
<b>Total</b>	<b>10472</b>	<b>1566</b>	<b>8906</b>	<b>2978</b>	<b>5928</b>	<b>66.56</b>

❖ અગત્યની સૂચનાઓ

- શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક: બમશ/૧૧૧૭/૨૪૨૫/ગ, તા:૦૯/૦૮/૨૦૧૭ મુજબ આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT)-૨૦૧૭ (Head Masters Aptitude Test (HMAT)-2017)માં તમામ કેટેગરીના ઉમેદવારો માટે કુલ ગુણના ૫૦% ગુણ એટલે કે કુલ ગુણ ૨૦૦ માંથી બંને વિભાગના સંયુક્ત રીતે મળીને ૧૦૦ ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવેલ છે.
- માત્ર કસોટીમાં પાસ થયેલ છે તેવા ઉમેદવારોને ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં સ્પીડ પોસ્ટ/રજીસ્ટર એડી મારફતે સંબંધિત ઉમેદવારો દ્વારા ઓનલાઇન આવેદનપત્ર ભરતી વખતે દર્શાવેલ સરનામા પર મોકલી આપવામાં આવશે.
- જે ઉમેદવાર પોતાની OMR Sheet ની પુનઃચકાસણી કરાવવા માંગતા હોય તે ઉમેદવાર તા:૧૬/૧૦/૨૦૧૭ અને તા:૧૭/૧૦/૨૦૧૭ ના રોજ કચેરી સમય દરમિયાન "રાજ્ય પરીક્ષા બોર્ડ, સરકારી પુસ્તકાલય પાસે, સેક્ટર-૨૧, ગાંધીનગર" ખાતે રૂબરૂ OMR Sheet ની પુનઃચકાસણી કરાવી શકશે. તા:૧૭/૧૦/૨૦૧૭ બાદ OMR Sheet ની પુનઃચકાસણીની કોઈપણ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
- OMR Sheet ની પુનઃચકાસણી કરાવવા માટે ઉમેદવારે પોતાની હોલટીકીટની નકલ તથા OMR Sheetની નકલ સાથે બોર્ડમાં લેખિત અરજી આપવાની રહેશે. આ ઉપરાંત OMR Sheet ની પુનઃચકાસણીની ફી પેટે રૂા ૧૦૦/- રોકડમાં રાજ્ય પરીક્ષા બોર્ડની હિસાબી શાખામાં જમા કરાવવાના રહેશે.

સ્થળ:ગાંધીનગર  
તારીખ:૧૩/૧૦/૨૦૧૭



(પી એ. જલુ)  
અધ્યક્ષ  
રાજ્ય પરીક્ષા બોર્ડ  
ગાંધીનગર

➤ પ્રતિ:

- માન. શિક્ષણમંત્રીશ્રીના અંગત સચિવશ્રી - શિક્ષણમંત્રીશ્રીનું કાર્યાલય, ગાંધીનગર.
- માન. રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રીશ્રીના અંગત સચિવશ્રી - શિક્ષણમંત્રીશ્રીનું કાર્યાલય, ગાંધીનગર.
- માન. અગ્રસચિવશ્રી, શિક્ષણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર.
- સંયુક્ત સચિવશ્રી, માધ્યમિક શિક્ષણ, નવા સચિવાલય, ગાંધીનગર.
- નિયામકશ્રી, શાળાઓની કચેરી, બ્લોક નં:૯/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.

- નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, બ્લોક નં:૧૨/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
- નિયામકશ્રી,ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.
- સચિવશ્રી, માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
- પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,તમામ.
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,તમામ.
- જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,તમામ.
- શાસનાધિકારીશ્રી, તમામ.